

સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગેનો તાલિમ વર્ગ યોજાયો

કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ તથા કૃષિ સાંસોધન કેન્દ્ર, સણસોલી દ્વારા સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગેની તાલિમ તા. ૧૦/૦૧/૨૦૨૩ થી ૧૩/૦૧/૨૦૨૩ દરમિયાન ગોઠવવામાં આવેલ. જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સણસોલી તાલુકાના જુદા જુદા ગામોમાં કુલ ૨૮ ખેડૂત ભાઈઓએ ભાગ લીધેલ. આ તાલિમ કાર્યક્રમનાં ઉદઘાટન સમારોહમાં ડૉ. ડી. બી. સિસોદીયા, પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ત્ર વિભાગએ યોજનાકીય માહિતી આપી તાલિમનાં મુખ્ય હેતુઓ અને ઉપયોગીતા વિષે ખેડૂતોને અવગત કર્યા હતા. ડૉ. જે. કે. પટેલ, યુનિટ વડાએ સંસ્થાકીય પરિચય આપ્યો હતો, જ્યારે ડૉ. આર. કે. હૂમર, પ્રાધ્યાપક અને વડા, કૃમિશાસ્ત્ર વિભાગએ ખેડૂતોને આવી કૃષિલક્ષી તાલીમોનો વધુમાં વધુ લાભ લઈ પોતાની ખેતી સમૃદ્ધ કરવા જણાવ્યું હતું. વિવિધ કૃષિ પાકોમાં નુકસાન કરતી જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન વિષય પર જુદા-જુદા નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને ઉડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવેલ. આ તાલિમ કાર્યક્રમમાં ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયાંના પાકો, બાગાયતી પાકો, ધાસચારાનાં પાકોને નુકસાન કરતી જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તે અંગે ઉડાણપૂર્વક ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલ. વાતાવરણીય ફેરફાર દ્વારા વિવિધ પાકમાં આવતી જીવાતોનું સમયસર સંકલિત વ્યવસ્થાપન અપનાવી જંતુનાશકોના આડેઘડ છંટકાવને ટાળવો જોઈએ તેમજ વિવિધ જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન કરી પાક સંરક્ષણ ખર્ચ ઘટાડી આવક કઈ રીતે વધારી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી. તેમજ રસાયણમુક્ત અને ગુણવત્તાસભર ખેત ઉત્પાદન મેળવવા માટે પણ તાલિમ આપવામાં આવેલ અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

તાલીમ દરમિયાન ખેડૂત ભાઈઓએ કૃષિ સાંસોધન કેન્દ્ર, સણસોલી તેમજ આણંદ, આણંદ ખાતે ધાસચારા સંશોધન કેન્દ્ર, પશુ સંશોધન કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર અને શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તાલિમ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓને પ્રાયોગિક તાલિમ પણ આપવામાં આવી હતી. ખેડૂતોએ સમાપન કાર્યક્રમ તેઓના પ્રતિભાવમાં તાલીમ વિશે જણાવેલ કે આ તાલીમ તેઓને ખૂબજ ઉપયોગી સાબિત થશે કારણ કે અત્યાર સુધી તેઓ જીવાત અને રોગ અંગે આટલી બધી સમજ ધરાવતા ન હતા. તેઓએ આવી તાલીમ રાખવા બદલ આણંદ કૃષિ યુનિવર્સિટી નો આભાર પણ માન્યો હતો અને તાલીમ જાણવાલાયક અને સંતોષકારક રહી તેમ જણાવ્યું હતું.

આ તાલિમ કાર્યક્રમનાં સમાપનમાં ડૉ. વાચ. એમ. શુક્લ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષએ આણંદ ખાતે ચાલતા કૃષિલક્ષી અભ્યાસક્રમોની માહિતી આપી તેમજ તાલિમની જાણકારી બીજા ખેડૂતો

સુધી પહોંચે તેવી અભ્યર્થના સાથે આશીર્વચન પાઠવેલ તથા તેઓશ્રીના હસ્તે પ્રમાણપત્ર અને કીટનું વિતરણ પણ કરવામાં આવેલ. જેમાં વિભાગના ડૉ. ડી. બી. સીસોદીયા, ડૉ. એચ. સી. પટેલ, ડૉ. એમ. બી. આલા અને મિનાક્ષી લુણાગરીયા હાજર રહ્યા હતા.



